



DRUGS AND CHEMICALS LIMITED

Registered Office :

815, Nilamber Triumph, Gotri-Vasna Road, Vadodara - 390 007. Gujarat (INDIA).

Ph. : +91-265-2991021 / 2991022

Email : admin@pardrugs.com

CIN No. : L24117GJ1999PLC035512

[www.pardrugs.com](http://www.pardrugs.com)

PAR/CS/NSE/2024-25/23

To,  
The Manager  
Listing department,  
**National Stock Exchange of India Limited**  
Exchange Plaza, C-1, Block-G,  
Bandra Kurla Complex, Bandra (E),  
Mumbai- 400 051  
Maharashtra

**Date:05/08/2024**

Subject: Submission of Newspapers Cutting of published Standalone Unaudited Financial Results for the quarter ended 30<sup>th</sup> June, 2024

Ref.: **Symbol- PAR, ISIN: INE04LG01015**

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose the cuttings of newspaper advertisement published in Newspaper dated August 05, 2024 in The Economic Times (English) and Navgujarat Samay (Gujarati), regarding Standalone Unaudited Financial Results for the quarter ended June 30, 2024

Copies of newspapers cutting in this connection are attached herewith.

The above information is also available on the website of the Company [www.pardrugs.com](http://www.pardrugs.com)

Kindly take on the record and acknowledge the receipt.

Yours Faithfully

**For PAR DRUGS AND CHEMICALS LIMITED**

\_\_\_\_\_  
**(Sanket B. Trivedi)**

**Company Secretary & Compliance Officer**

# Sports World Play

## Awesome India in Olympic Semis

Defend for over 43 mins with 10 men for 1-1 draw, then Sreejesh's heroics in shootout gives team 4-2 win over Great Britain and another medal hope



Boria Majumdar



Imagine playing 43 out of 60 minutes of an Olympic hockey quarter final match against Great Britain with 10 men. And, with nine for a few minutes in the crucial fourth quarter with score tied at 1-1.

That's what India was reduced to while playing when Amit Rohidas, India's best first rusher, was shown a red card for lifting his stick in the 7th minute of the game. India, though, did not lose hope took the lead through Harmanpreet Singh in the 22nd minute from a penalty corner before Britain drew level through Lee Merton from a field effort in the 27th minute.

It is the games and numerical superiority is often impossible to make up at this level unless someone plays the game of his lifetime. On Sunday goalkeeper PR Sreejesh did just that for India.

A man down, the Tokyo Games bronze medalists fell back to their defensive shape, something they had trained for during their many camps in the lead up to Paris.

"We will leave nothing to chance. Every single scenario will be worked on. If we are a goal down that should be the approach. If we are a man down that should be the approach," said Sreejesh when ET Sport had spoken to him before the Olympics. "Coach will get us ready for every eventuality".

Today his words seem prophetic. India needed captain Harmanpreet Singh and the senior players to just spread their wings, hold things together and then Britain. And if they failed, it was Sreejesh who had their back.

He was the last line of defence, and an im-

penetrable one. It was as if he just did not want to go back without a medal. The resilience and the hunger, borne out time and again was of a very different level.

Each time Britain came close, one could sense Sreejesh telling himself he would give it his all to protect his house, one that belongs to a billion plus people back home.

We often say the Indians lack mental fortitude, they don't handle pressure well. If defending like men possessed for almost 70 per cent of a last-eight game for 1-1 scoreline and then going on to win in the shootout 4-2 was both cerebral as well as heroic.

Two things define India's effort against Britain. The first and foremost is the determination not to lose. They want to repeat Tokyo and do even better. Even when the England goalkeeper was carrying a tab to the shootout, which the referee spotted at the end of the second goal and threw out, the Indians did not lose their cool. For them the purpose was simple. Come what may they had to win. However many decisions went against them, they wouldn't flinch.

"The refereeing was poor. When you are adjudicating at Olympic stage you expect much better. Today the players worked the hardest and pushed it to a shoot out and we won. But that doesn't mean that the refereeing was good. The red card was harsh and there were decisions that were contentious," said Dilip Tirkeri, Hockey India boss.

The second thing that we need to highlight is India's composure during the shoot out. While Sreejesh was at a different level, one also has to give credit to India's shooters who converted without any self doubt.

That's what it is all about in a shootout. Clarity. Uncoloured mind which isn't thinking of what happens if you don't score. Not thinking that a semifinal spot is on the line.

And it is only possible if you have complete control of your nerves and aren't impacted by fear of failure. The Indians wanted it more than Britain and that's what got them over the line.

### India's Boxing Campaign Ends With Lovlina's QF Loss

India's boxing campaign at the ongoing Olympics came to a medal-less end after Tokyo edition bronze-winner Lovlina Borgohain (75kg) bowed out following a hard-fought quarters loss to China's Li Qian in the women's competition in Paris on Sunday. Borgohain, the reigning world champion in the category, went down 1-4 to the Tokyo Games silver-winner 34-year-old On Saturday, Nishant Dev lost his 75kg quarters bout to Mexico's Marco Verde, PTI

### Lakshya Falls to Axelsen in Semis, to Play for Bronze Today

Lakshya Sen suffered a straight-game defeat to reigning champion Viktor Axelsen in the men's singles semifinals at the Paris Games on Sunday. The 22-year-old squandered a three-point advantage in the first game and a 7-0 lead in the second to lose 20-22, 14-21 to the two-time world champion in 54 minutes. Sen will get a chance to become the first Indian male shooter to win an Olympic medal when he meets Malaysia's Lee Zii Jia for bronze on Monday, PTI

## Focus on Profitable Businesses: FinMin to State-owned General Insurance Cos

New Delhi: The finance ministry has asked state-owned general insurance companies to focus on profitable businesses and not to chase top-line but aim for improving profitability.

The government has recently infused ₹ 250 crore in installments in three public sector general insurance companies - National Insurance Company Limited, Oriental Insurance Company Limited, and United India Insurance Company.

"We have been monitoring performance of

state-owned general insurance companies and as a result they have started looking up. So, we will watch their performance this year," Financial Services Secretary Vivek Joshi told PTI. Hopefully, he said, these companies may not require any further capital infusion, which is why the Budget has not made any provision. These three general insurance companies have improved their financial performance significantly, he said.

For instance, he said, Oriental Insurance has earned ₹18 crore profit in FY24 as against a loss of ₹5,000 crore a year ago, while National Insurance Company narrowly avoided a loss of ₹187 crore from ₹3,800 crore, and United India Insurance to a loss of ₹800 crore as against the loss of ₹2,800 crore in the preceding year that is FY23.

New India Assurance has continued to perform well, increasing its profits from ₹1,900 crore in FY23 to ₹1,100 crore in FY24. In addition to the shift in focus, the government is also addressing operational issues within these insurers. —PTI

## Dharavi Redevelopment Gets a Boost as Resident Body Supports Govt Survey

Mumbai: In a shot in the arm for redevelopment of Asia's biggest slum, a newly formed association of residents of Dharavi and its vicinity has lent its support to ongoing state government-led survey of informal tenements, a precursor to the \$3-billion project by the Adani group that promises to transform lives of an estimated one million residents.

"We request the survey be conducted at the earliest possible time to ensure that the redevelopment can move forward without further delays," Citizen and Society Development Welfare body of Dharavi residents wrote to S V R Srinivas, CEO Dharavi Redevelopment Project/Slum Rehabilitation Authority (DRP/SRA), of government of Maharashtra, on July 30.

Representatives of Citizen and Society Development Welfare, who have given the slogan of Dharavi Banao Andolan, met Srinivas and submitted a memorandum seeking expeditious of the survey being conducted in Dharavi.

The survey, which began on March 18, 2024, has so far completed 10,000 tenements via door-to-door visits while counting has been done on more than 21,000 tenements. This includes residential, commercial tenements and religious structures as well across Dharavi.

Mapping of the roughly 800 acres of densely populated Dharavi is crucial for the redevelopment that is likely to take seven years to complete. Eligible residents will get a 350 square foot flat in the area once the project is completed, while ineligible residents will be rehoused elsewhere in Mumbai. —PTI

**SURYODAY**  
A BANK OF SMILES

**UNAUDITED FINANCIAL HIGHLIGHTS FOR Q1 FY25**

Gross Advances	₹9,037 CRORES	41.8% ▲	Disbursement	₹1,740 CRORES	46.3% ▲
Deposit	₹8,137 CRORES	42.2% ▲	PAT	₹70.1 CRORES	47.2% ▲
NII	₹293 CRORES	+30.5% ▲	RoE	15.2%	+296 bps ▲
Pre-PoP	₹144 CRORES	23.2% ▲	GNPA'	2.7%	-33 bps ▼
			NNPA	0.4%	-116 bps ▼

(₹ in Crores)

Particulars	Quarter Ended June 30, 2024	Quarter Ended June 30, 2023
1. Interest Earned	488.1	358.1
2. Total Income	558.2	409.1
3. Interest Expended	194.9	133.4
4. Operating Expenses (including CGFMU)	219.1	158.7
5. Operating Profit before Provisions and Contingencies	144.3	117.1
6. Provisions (other than tax) and Contingencies	51.6	53.7
7. Profit (+)/ Loss (-) for the period (5-6)	92.7	63.4
8. Tax expense	22.7	15.8
9. Net Profit (+)/ Loss (-) for the period (7-8)	70.1	47.6
10. Ratios		
(i) Debt/Equity Ratio**	1.25	1.56
(ii) NPA Ratios		
a) % of Gross NPA	2.7%	3.0%
b) % of Net NPA	0.4%	1.6%
RoA	2.3%	2.0%
RoE	15.2%	12.3%

\*Includes SPC of ₹500 Crores.  
\*\*Debt represents total borrowings excluding deposits.  
This is a voluntary information in addition to statutory submission/publication made as per requirements.

Basavar Babu Ramachandran  
Managing Director and CEO  
DIN: 02303182

**Registered & Corporate Office: Suryoday Small Finance Bank Limited**  
1101, Sharada Terraces, Sector 11, CBD Belapur, Navi Mumbai - 400 614  
CIN:L65929MH2008PLC261472

**Espire**  
PREMIUM BANKING PROGRAMME

Curated Banking & Lifestyle Benefits

Get up to **9.1% on Fixed Deposit**  
(For Senior Citizens)

To apply for any banking products: 1800 266 7711 | suryodaybank.com | Follow us: [Social Media Icons]

## MAANAVEEYA DEVELOPMENT & FINANCE PRIVATE LIMITED

Prashanthi Towers, H. No. 8-4-293/302/564 A-43, 4th Floor, Road No. 92, Jubilee Hills, Hyderabad - 500034, Telangana, India.  
T: +91 (40) 23554729, E: office\_in@koKcredit.org, URL: www.maanaveeya.org, CIN: U65991TG2004PTC043539

Today, on 8th August, we proudly celebrate the 20th Anniversary of Maanaveeya, and reflect in two decades of unwavering commitment to delivering our mission of impact creation through access to finance, with our partner's support to empower bottom of the pyramid population. On this occasion, we express our heartfelt thanks to all our partners, shareholder, directors, staff and all other stakeholders for being part of the impactful growth journey over two decades, as this milestone signifies the enduring impact of our collective efforts in meeting our shared developmental goals.

### Extract of Audited Financial Statements for the year ended March 31, 2024

S. No.	Particulars	(₹. In Lakhs except EPS)	
		March 31, 2024 (Audited)	March 31, 2023 (Audited)
1	Total Income from Operations	22,893	18,868
2	Net Profit for the year before tax	10,423	9,062
3	Net Profit for the year after tax	9,386	6,498
4	Total Comprehensive Income for the year	9,371	6,501
5	Outstanding Loan Portfolio	1,84,648	1,63,594
6	Total Assets	1,95,582	1,71,205
7	Paid-up Equity share capital	22,865	22,865
8	Reserves	34,240	24,869
9	Security Premium Account	4,104	4,104
10	Net Worth	61,209	51,838
11	Earnings Per Share (Face value of ₹ 10 each) - Basic & Diluted (₹)	4.10	2.84
12	Capital to Risk Asset Ratio (CRAR) - %	31.29	30.15
13	Liquidity Coverage Ratio - %	130.00	279.00
14	Debt Equity Ratio - (no. of times)	2.17	2.28

Note: The above is an extract of the detailed Financial Statements of the Company which has been prepared in accordance with Ind AS prescribed under Section 133 of the Companies Act, 2013 approved by the Board, published voluntarily by the Company for the information of its stakeholders.

Place: Hyderabad  
Date: August 5, 2024  
For and on behalf of the Board of Directors  
Sd/-  
Dr. G. Gouri Sankar  
Managing Director (DIN: 06788500)



**PAR DRUGS AND CHEMICALS LIMITED**  
CIN: L24117GJ1999PLC035512  
Registered office: 815, Nilambar Triumph, Gotri Vasna Road, Vadodra-390007, Gujarat, India  
Phone No.: 0265-2991021, 0265-2991022  
Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

### Statement of Standalone Unaudited Financial Result for the Quarter Ended 30<sup>th</sup> June, 2024

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		30.06.2024 Unaudited	31.03.2024 Audited	30.06.2023 Unaudited	31.03.2024 Audited
1	Total Income from Operations	2267.91	2277.13	2294.68	9588.27
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	338.50	510.89	329.74	1951.66
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	338.50	510.89	329.74	1951.66
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	253.31	371.94	246.75	1450.10
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	253.31	371.94	246.75	1450.10
6	Equity Share Capital (Face Value per share Rs. 10/-)	1230.46	1230.46	1230.46	1230.46
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	-	-	-	7332.74
8	Earnings Per Share of Rs. 10/- Each (for continuing and discontinued operations) Basic as well as Diluted	2.06	3.02	2.01	11.78

Note: (a) The result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting held on 03/08/2024. (b) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Result for the Quarter ended 30<sup>th</sup> June, 2024 filed with the National Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended 30<sup>th</sup> June, 2024 are available on the website via https://www.nseindia.com/ and the website of the Company at www.pardrugs.com (c) Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable. (d) The Company is primarily engaged in manufacturing of API, which constitute single business segment in terms of Ind AS- 108 on "Operating Segments". Accordingly, there is no separate reportable segments as per Ind AS- 108.

Date: 03/08/2024  
Place: Vadodra  
For & on Behalf of the Board  
Par Drugs And Chemicals Limited  
Sd/-  
Mr. Falgun V. Savani (Managing Director)  
(DIN: 00198236)

